



ડ. આવક-શિરોમણિ સાહુ શ્રી શાંતિપ્રસાદજી

* બાળપણ અને ભાણતર : ૨૦મી સદીમાં થયેલા ઉત્તમ જેન સદ્ગુહસ્થોની પ્રથમ હરોળમાં જેમનું નામ પોતાની ગુણતિશ્યતાને લીધે સહજપણે શોભે છે તેવા ધર્મ, અર્થ, કામ અને મોકાને અવિદુદ્ધપણે સફળતાપૂર્વક સાધનાર આદરણીય શ્રીબીર્ધની શ્રી શાંતિપ્રસાદજીનો જન્મ તા. ૨૨-૫-૧૯૧૧ ના રોજ નજીબાબાદમાં થયો હતો. તેમની જન્મભૂમિ નજીબાબાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં આવેલી છે; ગઢવાલ જિલ્લાની સરહદ અને હિમાલયની તળોટી ત્યાંથી ખાલુ દૂર નથી. તેમના દાદાનું નામ સલેખંગ હતું. એક મહાન ધર્માન્ધી અને સમાજસેવક તરીકે તેઓ આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ હતા. શાંતિપ્રસાદજીના પિતાશ્રીનું નામ દીવાનસિહજ અને માતાજીનું નામ મૂર્તિદેવી હતું.

તેમનું પ્રારંભિક શિક્ષણ નજીબાબાદમાં થયું હતું અને કોલેજનું શિક્ષણ પ્રથમ મેરઠમાં અને ત્યાર પછી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં થયું હતું. ભાણવામાં તેઓ એક બુદ્ધિમાન વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે બી. એસ.સી. (B. Sc.)ની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પાસ કરી હતી.

* કુટુંબિક અને વ્યાપકાશિક જીવન : સાહુ પરિવારના ઉમદા, ઉદાર અને કુલીન સંસ્કારો તેમનામાં પ્રારંભિક યુવાવસ્થાથી જ જબકચા હતા. આ ઉમરે પણ નિયમિત પ્રભુદર્શન તથા આજુખાજુના હસ્તિતનાપુર આદિ તીર્થોમાં જવાનું તથા ધાર્મિક ઉત્સવોમાં ભાગ લેવાનું તેઓ ચૂકતા નહીં.

તેમનાં ધર્મપત્નીનું નામ રમારાણી હતું. રમારાણી પ્રસિદ્ધ મારવાડી ઉદ્યોગપતિ શ્રી. રામકૃષ્ણ દાલમીયાનાં એકનાં એક દીકરી હતાં. નાની ઉંમરમાં જ માતાનો વિયોગ થવાથી રમારાણીનો ઉછેર શેડ જમનાલાલ બજાળના સાંનિધ્યમાં થયો હતો. આથી દેશપ્રેમ, સ્વાત્રાય, આત્મવિશ્વાસ અને સર્વધર્મસમભાવના સંસ્કાર તેમને નાનપણુથી જ મહિયા હતા. શાન્તિપ્રસાદજીના લમસંબંધથી દેશના બે ઉચ્ચ સંસ્કારી અને સંપત્તિવાન કુટુંબોનું મિલન થયું, અને મહિં-કાંયનનો સંયોગ થાય તેમ દસ-પંદર વર્ણની અંદર વિશિષ્ટ પુરુષોદયથી તેમનું કુટુંબ ભારતનાં અગ્રગણ્ય કુટુંબોમાં વિશિષ્ટ સ્થાન પામ્યું. તેમના ત્રણ પુત્રોનાં નામ અશોક, આલોક અને મનોજ છે તથા પુત્રીનું નામ સૌ. અલ્ક છે. જેમ જેમ લક્ષ્મીનું આગમન થતું ગયું તેમ તેમ સમાજસેવા અને સંસ્કારનું સામ્રાજ્ય સર્વ કુટુંબીજનોમાં હેલાવા લાગ્યું. વિવિધ વ્યવસાય, ઉદ્યોગ અને વ્યાપકારમાં તેઓની કુશાગ્ર બુદ્ધિ, માણસોને પારખવાની શક્તિ, સ્ટાફ પ્રત્યેની ઉદાર નીતિ અને ઉદ્યોગપતિ અને વહીવિટકર્તા તરીકેની તેમની આગામી કોણસૂઝ-આ બધા દ્વારા ભારતના ઔદ્યોગિક ક્ષેત્રો થોડાં જ વર્ષોમાં તેમણે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધું. આમ દુનિયામાં દુર્લભ એવા લક્ષ્મી અને સરસ્વતીના સુભગ સમન્વયથી આ કુટુંબની ઘ્યાતિ દેશમાં સર્વત્ર પ્રસરણ લાગી.

માનવતાવાદ અને સમાજસેવાના જ્યોતિર્ધર : દયા, નભ્રતા, ઉદારતા, સાચાઈ, સરળતા, માનવમાત્ર પ્રયે પ્રેમ વગેરે ગુણો તેમને પોતાની ઉચ્ચ કુળપરંપરા તથા માતા મૂર્તિદેવી તરફથી ગણથ્યુથીમાંથી મળ્યા હતા. સમાજસેવાના કાચો કરવાની પણ તેમના વડીલોની એક પરંપરાગત આસ્તિયન હતી. સાહુજીના જીવનમાં તે અધ્યાત્ર વર્ણની ઉંમરથી જ દેખાય છે. ઈ. સ. ૧૯૨૮માં હસ્તિતનાપુરમાં મળેલા અખિલ ભારતીય યુવક-સંમેલનની કાર્યવાહીમાં તેમણે જે ભાગ ભજવ્યો હતો તેનાથી સમાજસેવા કરવાનો તેમનો અદ્ય ઉત્સાહ, સંગઠન કરવાની શક્તિ, વહીવટી કુશળતા, અને નાનામોટા સૌની સાથે હળીમળીને કામ કરવાની તેમની શક્તિનો આપણાને પરિચય મળે છે. ભાવિમાં ઘનાર તેમની મહાન નેતાજીરીનાં અંધાગું આ સમપથી જ અનુભવીઓના ઘ્યાલમાં આવી ગયા હતા. જેને ૧૯૪૦ના ઉનાણામાં લખનૌમાં ભરામેલ ભારતવર્ષિય દિગ્ંબર જેણ પરિષદના વાણિક અધિવેશનમાં તેમણે તથા રમારાણીએ આપેલા સેવાઓ, માર્ગદર્શન, પ્રેરણા અને બનાવેલા અથાગ ઉત્સાહથી તે જમનામાં જેણ લોકો તેમને પોતાના નેતા અને માર્ગદર્શક માનવા લાગ્યા હતા. વિધવાવિધાન, આંતરજાતીય વિવાહ, દહેન-નિવારણાનો પ્રક્રષ્ટ તથા નવી અને જૂની પેકી વચ્ચેના તીવ્ખ મનલેદો જેવી વિવિધ સમાજિક સમસ્યાઓનું પથાયોગ્ય નિરાકરણ કરી બહુજનમાન્ય ઉકેલ શોધવામાં તેઓને

સારી સફળના પ્રાપ્ત થઈ હતી. વળી, જેન એકત્રાના પ્રયાસમાં પણ ભારત જેન મહા-મંડળ નેવી જૂની સંસ્થાના કર્ણધાર બનીને તેઓએ જાતિબાધુઓને પ્રોત્સાહન આપ્યું હતું. સમસ્ત દિગ્ંબર જેન સમાજનો એક સર્વમાન્ય સંસ્થા બનાવવાના અને સૌમાં સાધમાણવાનસલ્ય વધારવાના હેતુથી સનું ૧૯૭૪માં તેઓએ દિગ્ંબર જેન મહાસમિતિની સ્થાપના કરી. ભારતના સ્વતંત્રય-સંગ્રહમાં તેમજ સનું ૧૯૭૫ તથા ૧૯૭૧નાં યુદ્ધો દરમિયાન તેઓએ લાલબહાડુર શાંક્રીજ તથા શ્રીમતી ઈન્દ્રા ગાંધીની સાથે લંબાણ ચર્ચા કરીને સર્વતોમુખી સહયોગ આપ્યો હતો. જનરલ હોસ્પિટલો, વિશ્વવિદ્યાલયો અને જહેર શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણમાં પણ તેમણે ઉદારનાથી દાન-ગંગા વહેવરાવી હતી.

શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ તથા ધર્મ અંગેની સેવાઓ : વિશિષ્ટ પુષ્પોદય, ન્યાયસંપન્ન ઉદ્ઘોગ-વ્યવસાયની નીતિઓ અને સાતિશય વ્યાપારી કુનેખથી જેમ જેમ લક્ષ્મી એકપારી વધવા લાગી, તેમ તેમ સાહુ પરિવારે સમાજ અને સંસ્કૃતિના ઝર્યો માટે અત્યાં ઉદાર દાનનીતિનો આશ્રય લીધો. આનું કાઈક અનુમાન તેમણે કરેલા નીચેનાં ઝર્યોથી જાણી શકાય :

(૧) સનું ૧૯૭૧માં મૂર્તિદેવી કન્યાવિદ્યાલયની નાનાભાદમાં સ્થાપના.

(૨) સાહુ જેન ટ્રસ્ટના અન્યે “મૂર્તિદેવી છાત્રવૃત્તિઓ” સ્વાદવાદ મહા-વિદ્યાલય બનારસમાં શાલો, આચાર્ય એમ. એ., પૌચ્ચે. ડી તથા ડી. લિટ.ની ડિગ્રીઓ માટે ભાગના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સેક્ટરો વિદ્યાર્થીઓએ આ છાત્રવૃત્તિનો લાલ લીધો છે અને દેશના જુદા જુદા ભાગોમાં ધર્મ, દર્શન, સાહિત્ય, ઈતિહાસ, તેમજ સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓના પ્રચાર-પ્રસારમાં પોતાની સેવાઓ આપ્યો છે.

(૩-૪) ભારતીય શાનદાર તથા મૂર્તિદેવી ગ્રંથમાળા : તા. ૧૮-૨-૧૯૭૪ના રોજ સાહુ શાન્તિપ્રસાદજીએ પોતાના કુટુંબીજનોના સહયોગ અને સંમિલિથી આ મહાન સંસ્થાઓની સ્થાપના કરી. આ સંસ્થાઓ દ્વારા ઉત્ત્યક્ષાત્મનું પ્રાર્ચીન તેમજ અર્વાચીન સાહિત્ય વિપુલ પ્રમાણમાં સંસ્કૃત, હિન્દી, પ્રાકૃત, અંગ્રેજી, તામિલ, કન્નડ વગેરે ભાષાઓમાં પ્રગટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અધ્યતન વૈજ્ઞાનિક ડબથી સંપાદિત લગભગ ૧૦૦ (સો) જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે.

(૫) શાનદાર એલોર્ડ : દર વર્ષે ભારતના સંવિધાને માન્ય કરેલ મુખ્ય ચૌદી ભાષાઓમાં પ્રગટ થયેલા સાહિત્યમાંથી માનવતાલક્ષી તેમજ સંસ્કરાપ્રેરક શ્રેષ્ઠ કુનિને રૂ. દોઢ લાખ રોકડાનું પારિનોષિક અપાય છે અને તેના કર્તાનું શાલ ઓકાડી સન્માન કરવામાં આવે છે. આવી રાષ્ટ્રીય સનરની સાહિત્યક પ્રવૃત્તિ ભારતના ઈતિહાસમાં હજ સુધી બીજી નોંધાઈ નથી. આચાર્ય આ રોજનાના પુરસ્કર્તાઓની દૂરંદેશી, ઉદારતા, સાહિત્ય-પ્રેમ અને રાષ્ટ્રીય ભાવના પ્રત્યે કોઈ પણ મનુષ્યને સ્વાભાવિકપણે સન્માન અને આદરની લાગાણી ઉપજ્યા વગર રહી શકતી નથી.

(૬) પગકારિત્વના વિષયમાં વિશિષ્ટ યોગદાન : વિશાળ ઔદ્યોગિક અને વ્યાપારી કાર્યવાહીઓ સાથે સંબંધ હોવાથી વિજ્ઞાપનકાર્ય માટે નેમના પરિવારને ભારતના વિવિધ સમાચારપત્રો અને પત્રિકાઓ સાથે સંબંધ રહેતો.

સને ૧૯૪૫ની આજુબાજુ 'નવભારત ટાઈમ્સ'નું પ્રકાશન દિલ્હીથી ચાલુ થયું. અને ૧૯૪૫માં બેનેટ ક્રેલમેન કંપની 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'ના મૂળ માલિક પાસેથી સાહુ કુટુંબના હસ્તક આવી. તે સમયથી માર્કીને આજ સુધી તેઓએ ભારતીય પત્ર-કારન્ટવમાં પોતાના જીવની કાર્યક્રમતા અને વિવિધતા, પ્રચાર અને પ્રસારણ, ઉચ્ચ-ક્ષાળનું રહે અને અંગ્રેજ જેટલું જ, બલકે તેથી પણ વધારે મહત્વ હિંદી ભાષાને મળે તેવો પ્રશંસનીય પ્રયત્ન કરીને તેમણે હિંદી ભાષાના રાષ્ટ્રીય દરજાને સક્રિય અનુમોદન આપ્યું છે.

ઉપર્યુક્ત કાર્યો ઉપરાંત સમર્થ ભારતમાં અનેક વિદ્યાલયો, પાઠ્યાણાઓ, પુસ્તકાલયો અને શોધ-સંસ્થાઓને નેમજ અસંખ્ય ગરીબ વિદ્યાર્થીઓને તેઓએ દિલ્હીના પ્રગત નેમજ ગુપ્ત બન્ને રીતે સહાય કરી હતી.

વિશિષ્ટ ધાર્મિક સેવાઓ

(૧) ભગવાન મહાવીરના ૨૫૦૦ મો નિર્વાણ-મહોન્સવ પ્રાર્દ્ધિક, રાષ્ટ્રીય નેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અન્યાંત સફળતાપૂર્વક ઉજવાયો હતો. આ મહોન્સવનું સૌથી વધારે શ્રેય જો કોઈ એક વ્યક્તિને આપવું હોય તો તે વ્યક્તિ સાહુ શાન્તિપ્રસાદજીને જ આપી શક્ય. પોતાના અંગત સંબંધોનો સદ્ગુપ્ત્યોગ કરીને તેઓએ તે વખતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા કેન્દ્ર સરકારના અન્ય પ્રધાનોને આ મહોન્સવમાં સક્રિય રસ લેના કર્મ હતા. ભગવાન મહાવીરના રાષ્ટ્રીય સ્મારક માટે તેમણે દિલ્હીમાં જ સરકાર દ્વારા જમીનની ફળવણી કરાવી આપી હતી. મહોન્સવ-સમિતિના નેઓ કાર્યક્રમ હતા. રાષ્ટ્રીય, પ્રાંતીય, નિલ્લાકીય અને તાલુકા સ્તરે વિવિધ જેન સમિતિ-ઓની રચનાની તેઓએ જ પ્રેરણ આપી હતી, જેથી મહોન્સવ માત્ર મોટાં શહેરો પૂર્તો જ મર્યાદિત ન રહેતા ભારતનાં નાનાં નાનાં ગામડાં સુધી પણ પ્રસરે અને ભગવાન મહાવીરનો વિશ્વમૈત્રી, સર્વધર્મસિમભાવ અને આધ્યાત્મિકતાનો સંદેશ સૌ કોઈને પ્રામ થઈ શકે. પોતાની દિલ્હી, કલકત્તા, મુંબઈ અને અન્ય શહેરોની ઔદ્યોગિક માર્કેટ્સની આ કાર્ય માટે તેઓએ ફળવી આપ્યાં હતાં. મહોન્સવમાં ભારતના ચારેય જેન સંપ્રદાયોના અગ્રણીઓને દિલ્હીમાં એક ધ્વજ નીચે લેગા કરવાનું તથા 'સમરાસુંત' પ્રકાશનનું સારુ એવું શ્રેય શ્રી સાહૂજીને ફાળે જાય છે.

(૨) જેન વિદ્યા પ્રાન્યે અનુપમ ભક્તિઃ સને ૧૯૬૮માં બનારસ-સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ઉપકરે ઔદ્યોગિક એન્ટ્રેનિંગ એરિયાનું અધિવેશન ભરાયું હતું. આ અધિવેશનમાં જેન વિદ્યા અંગેનો કોઈ કાર્યક્રમ નહોતો. જ્યારે સાહૂજીને આ ભાબતની ખબર પડી ત્યારે તેઓએ કેટલાંક તાત્કાલિક પગલાં ભરીને જેનવિદ્યા

વિષેની વિશિષ્ટ સંગ્રહેણિનું આયોજન કરાવ્યું, જેમાં જેનવિદ્યાના મૂર્ધન્ય વિદ્વાનોને આમંત્રણ આપીને ખાસ બોલાવવામાં આવ્યા હતા.

ઉપરોક્ત તેઓએ નીચેની ધાર્મિક-સાંસ્કૃતિક સંસ્થાઓની સ્થાપના કરી અથવા તો તેમને વિશિષ્ટ સહયોગ આપી સક્રિય બનાવી :

(૧) પ્રાકૃત શોધ-સંસ્થાન, વૈશાલી, બિહાર, (૨) સ્વાધ્યાવાદ મહાવિદ્યાલય, બનારસ (૩) એસ. પી. જેન કોલેજ, સાસારામનગર, બિહાર, (૪) અહિસા-પ્રચારક સમિતિ, કલકત્તા, (૫) વણી સંસ્કૃત વિદ્યાલય, સાગર, (૬) સાહુ પુરાતત્વ મ્યુઝિયમ, દેવગઢ, (૭) ભારતવાચીય ટિગાબર જેન નીથિક્ષેત્ર કમિટી, મુંબઈ, (૮) ટિગાબર જેન મહાસમિતિ, (૯) સાહુ જેન કોલેજ નજીબાબાદ, (૧૦) ભારતીય કલાવિદ્યા જેન શોધ સંસ્થાન, મુડિબદ્રી કાર્યાલય, (૧૧) શામારુ જેન અજન પ્રચારક સંધ્ય, (પ્રેરક મુનિ વિદ્યાનંદજી) દિદ્ધિ.

અન્ય ધાર્મિક કાર્યો

(૧) 'ધોરણિવાણી ભારતી' દ્વારા ભારતના બધા ટોચના જેન વિદ્વાનોને સંપ્રદાયના ભેદભાવ વિના પુરસ્કૃત કર્યા.

(૨) એમના છુફનનાં છેલ્લાં ૨૫ વર્ષ દરમ્યાન પ્રાંતીય કે રાષ્ટ્રીય સતરનો એવો ધાર્મિક ઉત્સવ ભાગ્યે જ હશે કે જેમાં તેઓએ પ્રન્યાત્રા કે પરોક્ષ ઇથે હાજરી આપીને તેને નેતૃત્વ, માર્ગદર્શન અને વિશિષ્ટ સહાય પૂરી ન પાડી હોય.

(૩) જેન ધર્મના બધા ત્યાગી મુરુંથી તથા વિદ્વાનો પ્રન્યે તેમને ધારો જ પૂજય-ભાવ તથા આદરભાવ હતો. પોતાના ભરચુક કાર્યક્રમોમાંથી પણ વારેવાર સમય કાડીને તેઓ મુનિઓના સત્તુસમાગમ અને દર્શનનો લાભ લેતા તથા વિદ્વાનોની સભામાં નર્વશાન, અધ્યાત્મમચર્ચા, મુનિચર્ચા, આવકચર્ચા વગેરે વિષયો ઉપર સક્રિયપણે થય્યી કરતા.

(૪) સમસ્ત ભારતના જેનોના અગ્રગણ્ય નેતા હોવાની રૂએ જેન સમાજને કોઈ પણ પ્રકારનો અન્યાન્ય થતો હોય એવા પ્રસંગો ઉત્ત્મા થતા ત્યારે તેઓ તરત જ સક્રિય રસ લઈને વિવિધ ઉપાયો દ્વારા તેનું નિરાકરણ કરતા.

ઉત્તરાધિકારીની સંસ્થા : ભગવાન મહાવીરના નિર્વાણ-મહોત્સવ દરમ્યાન એમના આત્મામાં અદરમય ઉત્સાહ હતો. તેથી પ્રેમપરિશ્રામ પણ તેને અનુદ્દ્દેશ જ થયો. પરંતુ શરીર નો શરીરની રીતે જ કામ કરે ને? અર્થાત્ અધિક બોજાથી તેમના શરીર પર ધારુણી અસર થઈ. તેમાં વળી પોતાને આજીવન સહયોગ અને પ્રેરણા આપનાર તેમનાં ધર્મપણી રમારાણીનો તા. ૨૨-૭-૧૯૭૫ના રોજ વિદ્યોગ થતાં તેમને સ્વાભાવિકપણે જ ધારો માનસિક આધ્યાત્મ લાગ્યો. આ બધાની શરીર પર વિપરીત અસર થતી ગઈ. જો કે તેમને ધારુણી સમતા રાખી, છતાં ફદ્દયરોગની બીમારીએ તેમને ઘેરી લીધા અને કરાળ કાળ આ મહાયુરુપનો પણ તા. ૨૭-૧૦-૧૯૭૭ ના રોજ કોણિયો કરી ગયો. લાખો

આંખોમાંથી અશુની ધારાઓ ચાલી. સમગ્ર ભારત જેન સમાજે શોકઠરાઓ પસાર કર્યા. પરંતુ જેન-જ્યોતિન-પુંજમાંથી હવે પ્રકાશ ન મળતાં, જેન સમાજ અને વિશેષ કરીને દિગંબર જેન સમાજ નિરાશા, સર્વમાન્ય નેતૃત્વહીનતા અને નિરાધારતાનો અનુભવ કરી રહ્યો છે.

ઉપરાંહાર : આમ સતત ચાર દાયકાઓ સુધી પોતાની બહુમુખી પ્રતિભા અને દૂરદૂષી દ્વારા રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યક તથા ધાર્મિક સતરે જેન સમાજને વિશિષ્ટ સેવાઓ આપનાર આ મહાપુરુષ આને આપણી વરચ્ચે નથી; પણ તેમનાં સત્તુકાર્યોની સુવાસ અને ઉત્સાહ માનવમાત્રને અને આપણી યુવાન પેઢીને સેવાનો, સમર્પણનો, માનવતાનો અને સતત ઉઘમશીલતાનો સંદેશો આપે છે. આપણને તેમના જીવનમાંથી ઉદાર માનવલક્ષી અભિગમ અને સમાજસેવાની તત્પરતાની પ્રેરણ મળે છે. સાહૂજીની સર્વમાન્ય લોકપ્રિયતા અને સમુચ્ચેદ સફળતામાં તેમના ધર્મપત્ની સૌમ્યમૂર્તિ, આદરણીયા રમારણીનો હિસ્સો ખૂબ જ નોંધપાત્ર છે. સેવાભાવ, પ્રેમ, વાત્સલ્ય, સતત પ્રેરણ, વિકટ અણમાં ધીર્ય બંધાવવાની ક્રમતા અને જીવનના દરેક ક્ષેત્રમાં ઉદાર દિદ્ધકોર્ણ અપનાવવાની નીતિ-આદિ અનેક વિશિષ્ટતાઓ દ્વારા તેમણે સાહૂજીના વિકિતાત્વને કંડારવામાં એક મહાન સહયોગી અને સાચા જીવનસાથી તરીકેની પોતાની પ્રતિભાનો સૌને પરિચય કરાયો છે.

સાહૂજીના અનુગ્રામીઓ-વડીલબંધુ શ્રી શ્રેયાંસપ્રસાદજી તથા સુપુત્ર શ્રી અશોક-કુમાર જેન પણ તેમના પગલે ચાલીને સમાજને સારી એવી સેવાઓ આપે છે, જેથી આપણને તેમના વિમોગથી ઊપજેલી ખોટમાં હીકીંદીક ધીરજ અને આશ્વાસન બંધાય છે.